

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટને સાઉથ ફ્લેચર્સ સ્પોર્ટ્સપ્લેક્સમાં કમ્યુનિટી યુથ હબ બનાવવા ફેડરલ અને પ્રોવિન્સિયલ રોકાણો સુરક્ષિત કર્યા

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (માર્ચ 5, 2021) – આજરોજ, મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown); બ્રેમ્પટન સીટી કાઉન્સિલર્સ; માનનીય ક્રેથેરિન મેકેન્ના (Catherine McKenna), મિનિસ્ટર ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ કમ્યુનિટીસ વતી સોનિયા સિધુ (Sonia Sidhu), મેમ્બર ઓફ પાર્લામેન્ટ ફોર બ્રેમ્પટન સાઉથ; માનનીય લૉરી સ્કોટ (Laurie Scott), ઓન્ટેરિયો'સ મિનિસ્ટર ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વતી માનનીય પ્રબમીત સરકારિયા (Prabmeet Sarkaria), એસોસિએટ મિનિસ્ટર ઓફ સ્મોલ બિઝનેસ એન્ડ રેડ ટેપ રિડક્શન અને મેમ્બર ઓફ પ્રોવિન્સિયલ પાર્લામેન્ટ ફોર બ્રેમ્પટન સાઉથ; અને અમરજોત સંધુ (Amarjot Sandhu), મેમ્બર ઓફ પ્રોવિન્સિયલ પાર્લામેન્ટ ફોર બ્રેમ્પટન વેસ્ટ દ્વારા બ્રેમ્પટનમાં સાઉથ ફ્લેચર્સ સ્પોર્ટ્સપ્લેક્સમાં આગામી કમ્યુનિટી યુથ હબ માટે ભંડોળ આપવાની ઘોષણા કરવામાં આવી.

ઈન્વેસ્ટિંગ ઇન કેનેડા યોજનાની કમ્યુનિટી, કલ્ચર એન્ડ રિક્રિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રીમ (CCRIS) મારફતે ગવર્નમેન્ટ ઓફ કેનેડા આ પ્રોજેક્ટમાં \$565,000 નું રોકાણ કરી રહ્યું છે. ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયો આ પ્રોજેક્ટ માટે \$476,619 નું ભંડોળ, જ્યારે સીટી ઓફ બ્રેમ્પટન \$381,381 નો ફાળો પૂરો પાડી રહ્યું છે.

સાઉથ ફ્લેચર્સ સ્પોર્ટ્સપ્લેક્સમાં કમ્યુનિટી યુથ હબ જુવાનોને લગતા કાર્યક્રમો, સેવાઓ અને પ્રવૃત્તિઓમાં સહભાગી થવા બ્રેમ્પટનના જુવાનોને સુરક્ષિત અને પહોંચ સુલભ જગ્યા પૂરી પાડશે. સાઉથ ફ્લેચર્સ સ્પોર્ટ્સપ્લેક્સમાંના હાલના કેટલાક રૂમોને જુવાનો માટેની પ્રવૃત્તિઓ અને સંસાધનો માટે એક મુક્ત કલ્પના, સમર્પિત જગ્યામાં રૂપાંતરિત કરવામાં આવશે.

જુવાનો-કેન્દ્રિત જગ્યાઓ સુધી પહોંચ સુદૃઢ બનાવવી એ સીટી ઓફ બ્રેમ્પટનના [પાર્ક્સ અને રિક્રિએશન માસ્ટર પ્લાન](#)નો ભાગ છે. સીટી ઓફ બ્રેમ્પટન બે મનોરંજન કેન્દ્રો – સાઉથ ફ્લેચર્સ સ્પોર્ટ્સપ્લેક્સ અને સેન્યુરી ગાર્ડન્સ રિક્રિએશન સેન્ટરની જગ્યાને કમ્યુનિટી યુથ હબમાં રૂપાંતરિત કરવાની યોજના ધરાવે છે, જે જુવાનોને સુરક્ષિત અને આવકાર્ય જગ્યાઓ આપશે જે શહેરભરમાં જુવાન લોકો માટે સેવાઓ અને પ્રવૃત્તિઓ માટે વન-સ્ટોપ શોપ તરીકે કામ કરે છે.

રહેવાસીઓ અને હિતધારકો સાથે [સીટીની સલાહ-મસલત પ્રક્રિયા](#) થકી મંતવ્યો-સૂચનો વડે, બંને કમ્યુનિટી યુથ હબ માટેની ડિઝાઇન પ્રક્રિયા વર્ષ 2021 નાં શિયાળામાં શરૂ થશે.

યુથ ફેન્ડલી કમ્યુનિટી રેઝિગ્નેશન

માર્ચ 2020 માં, સીટી ઓફ બ્રેમ્પટનને પાર્ક્સ એન્ડ રિક્રિએશન ઓન્ટેરિયો દ્વારા સહાયભૂત કાર્યક્રમ, પ્લે વર્ક્સ તરફથી ફ્રી એકવાર પ્લેટિનમ યુથ ફેન્ડલી કમ્યુનિટી સ્ટેટસ (જુવાનોને અનુકૂળ સમુદાય મોબો) મળ્યો છે. જુવાનિયાઓને વૃદ્ધિ અને વિકાસ તકો આપવા સીટીની પોતાની ઉત્કૃષ્ટ કટિબદ્ધતા બદલ ઓળખ મળવાનું આ ત્રીજી વખત બન્યું છે, અને તે આ વર્ષે ટોચનું પ્લેટિનમ પદ મેળવનાર ત્રણ સમુદાયોમાંનો એક સમુદાય બન્યો છે. વધુ માહિતી મેળવવા [અહીં ક્લિક કરો](#).

કડીઓ (લિંક્સ)

- [મીડિયા પ્રકાશન: બ્રેમ્પટનમાં સાઉથ ફ્લેચર્સ સ્પોર્ટ્સપ્લેક્સમાં કમ્યુનિટી યુથ હબ બનાવવા કેનેડા અને ઓન્ટેરિયો રોકાણ કરે છે](#)
- [કમ્યુનિટી યુથ હબ્સ](#)
- [પાર્ક્સ એન્ડ રિક્રિએશન માસ્ટર પ્લાન](#)
- [યુથ ફેન્ડલી કમ્યુનિટી ડેવલપમેન્ટ \(જુવાનોને અનુકૂળ સમુદાય પદ\)](#)

અવતરણો (ક્વોટ્સ):

“અમે સાઉથ ફ્લેચર્સ સ્પોર્ટ્સપ્લેક્સમાં બ્રેમ્પટનના કમ્યુનિટી યુથ હબમાં ગવર્નમેન્ટ ઓફ કેનેડાના અને ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયોના રોકાણોને આવકારીએ છીએ. બ્રેમ્પટન કેનેડામાં સૌથી જુવાન શહેરોમાંનું એક શહેર છે, જેમાં 130,000 ઉપરાંત જુવાનોની ઉંમર 14 થી 29 વર્ષની છે. કમ્યુનિટી યુથ હબ્સ વિવિધતા અને સમાનતાને પ્રોત્સાહિત કરશે, નવીન સામેલગીરીને પ્રોત્સાહન આપશે, અને જુવાનો માટે સુરક્ષિત જગ્યાઓ પૂરી પાડશે, અને કાઉન્સિલની અગ્રતાની પરિભાષાને આગળ વધારશે કે બ્રેમ્પટન એક આરોગ્યપ્રદ અને સુરક્ષિત શહેર છે.”

- *પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન*

“બ્રેમ્પટનના કમ્યુનિટી યુથ હબ્સમાંના એકમાં ફેડરલ અને પ્રોવિન્સિયલ રોકાણો બ્રેમ્પટનના જુવાનો માટે આ જગ્યાઓ બનાવવાના આપણાં પ્રવાસમાં એક ઉત્તેજક વિકાસ છે. આપણે આગળ વધીએ તેમ, અમે જુવાનોની જરૂરિયાતોને અનુરૂપ ચોક્કસ કાર્યક્રમો અને સેવાઓ વડે આ ગતિશીલ જગ્યાઓ બનાવવા જુવાનો સાથે સહયોગ સાધીને સાથે પ્રવૃત્તમય થઈ રહ્યાં છીએ.”

- *રોવેના સેન્ટોસ (Rowena Santos), પ્રાદેશિક કાઉન્સિલર વોર્ડ્સ 1 અને 5; પ્રમુખ, કમ્યુનિટી સર્વિસીસ, સીટી ઓફ બ્રેમ્પટન*

“વોર્ડ 4 માટેના કાઉન્સિલર્સ તરીકે, અમે બ્રેમ્પટનમાં બે યુથ હબ્સના વિકાસ માટે સીટી અને રીજીયનલ કાઉન્સિલમાં હિમાયત કરી છે. અમે આ પ્રોજેક્ટને આગળ વધારતું પ્રોવિન્સિયલ અને ફેડરલ સરકારોનું આજનું રોકાણ આવકારીએ છીએ અને તેનાથી બ્રેમ્પટનમાં જુવાનો માટે નવી તકો ઊભી થશે. સીટીએ આ પ્રોજેક્ટ માટે વિસ્તારના જુવાનો પાસેથી સક્રિય રીતે પ્રતિભાવ માંગ્યો છે અને અમે સાઉથ ફ્લેચર્સ સ્પોર્ટ્સપ્લેક્સમાં યુથ હબ વિકસાવીએ એટલે તેઓનો પ્રતિભાવ સમાવવાની આશા રાખીએ છીએ.”

- *માર્ટિન મેડેરોસ (Martin Medeiros), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 3 અને 4, અને જેફ બોમેન (Jeff Bowman), સીટી કાઉન્સિલર, વોર્ડ્સ 3 અને 4, સીટી ઓફ બ્રેમ્પટન*

“સીટી કર્મચારીઓ આપણાં જુવાનોની ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ આ યુથ જગ્યાઓનું આયોજન કરવા અને ડિઝાઇન બનાવવા સમર્પિત છે, અને આ રોકાણોથી આપણને સાઉથ ફ્લેચર્સ સ્પોર્ટ્સપ્લેક્સમાં કમ્યુનિટી યુથ હબ બનાવવામાં સહાયતા મળશે. અમે અમારા હિતધારકો સાથે કામ કરવાનું અને આ જુવાનો માટેની વિશિષ્ટ જગ્યાઓ સ્થાપવા અમારા જુવાનિયાઓ સાથે પ્રવૃત્તમય રહેવાનું ચાલુ રાખવા આશાવાદી છીએ.”

- *ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન*

“મનોરંજન કેન્દ્રોમાં રોકાણ કરવાથી લોકોનું આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન મળે છે અને લોકો જ્યાં રહેવા, કામ કરવા અને કુટુંબો ઉછેરવા ઈચ્છતા હોય ત્યાં સર્વગ્રાહી અને કાયમી સમુદાયોનું નિર્માણ થાય છે. સાઉથ ફ્લેચર્સ યુથ હબ બ્રેમ્પટનમાં બંધી પશ્ચાદભૂના જુવાનોને સહભાગી થવા, અને તેમાંથી લાભ મેળવવા સુરક્ષિત જગ્યા પૂરી પાડશે. કાર્યક્રમો અને સેવાઓની વૈવિધ્યસભર શ્રેણી ભાવિ સામુદાયિક વિકાસમાં પણ ફાળો આપશે. કેનેડાનો ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન હજારો પ્રોજેક્ટ્સમાં રોકાણ કરે છે, દેશભરમાં રોજગારનું સર્જન કરે છે, અને વધારે સાફ, વધારે સર્વગ્રાહી સમુદાયોનું નિર્માણ કરે છે.”

- *માનનીય કેથેરિન મકેનના (Catherine McKenna), મિનિસ્ટર ઓફ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ કમ્યુનિટીસ વતી સોનિયા સિધુ (Sonia Sidhu), મેમ્બર ઓફ પાર્લામેન્ટ ફોર બ્રેમ્પટન સાઉથ*

“બ્રેમ્પટનની મનોરંજનલક્ષી જગ્યાઓમાં રોકાણ કરીને આજે, આપણે આગામી વર્ષો માટે આપણાં સમુદાયની લાંબા-ગાળાની વૃદ્ધિ અને વિકાસમાં રોકાણ કરી રહ્યાં છીએ. સાઉથ ફ્લેચર્સ સ્પોર્ટ્સપ્લેક્સમાં નવું યુથ હબ આવવાથી આપણાં જુવાનોને એકઠા થવાનું સ્થળ, અને આપણાં સમુદાયને એકબીજા સાથે સંકળાવવા નવી જગ્યાઓ મળશે.”

- માનનીય લૉરી સ્કોટ (Laurie Scott), ઓન્ટેરિયો'સ મિનિસ્ટર ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વતી માનનીય પ્રભમીત સરકારિયા (Prabmeet Sarkaria), એસોસિએટ મિનિસ્ટર ઓફ સ્મોલ બિઝનેસ એન્ડ રેડ ટેપ રિડક્શન અને મેમ્બર ઓફ પ્રોવિન્સિયલ પાર્લામેન્ટ ફોર બ્રેમ્પટન સાઉથ

“સાઉથ ફ્લોયર્સ યુથ હબ જેવી સ્થાનિક મનોરંજનલક્ષી સગવડ માટે ભંડોળ પૂરું પાડનાર આપણાં મ્યુનિસિપલ ભાગીદારોને ટેકો આપવાથી વધારે સુદૃઢ, ખુશ, સુરક્ષિત, અને આરોગ્યપ્રદ સમુદાયોનું નિર્માણ થાય છે. આપણી સ્થાનિક જાહેર માળખાગત સગવડમાં આ રોકાણથી આપણાં સમુદાયે વિકસવાનું અને વિસ્તરવાનું ચાલુ રાખ્યું છે ત્યારે બ્રેમ્પટનના જુવાનો માટે જીવનની ગુણવત્તા સુધરશે.”

- અમરજોત સંધુ (Amarjot Sandhu), બ્રેમ્પટન વેસ્ટ માટે પ્રોવિન્સિયલ પાર્લામેન્ટના સભ્ય

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો ડાઠ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca

શેન્ટેલ ઓબર્ટિન (Chantalle Aubertin)

પ્રેસ સેક્રેટરી (Press Secretary)

ઓફિસ ઓફ ધી મિનિસ્ટર ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ કમ્યુનિટીસ

613.941.0660 | chantalle.aubertin@canada.ca

ક્રિસ્ટિન બુજોલ્ડ (Christine Bujold)

પ્રેસ સેક્રેટરી (Press Secretary)

ઓફિસ ઓફ ધી ઓનરેબલ લૉરી સ્કોટ, ઓન્ટેરિયો'સ મિનિસ્ટર ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

416.454.1782 | christine.bujold@ontario.ca

સોફિયા સોઝા-ડિઆસ (Sofia Sousa-Dias)

કોમ્યુનિકેશન્સ બ્રાંચ (Communications Branch)

ઓન્ટેરિયો મિનિસ્ટ્રી ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Ontario Ministry of Infrastructure)

437.991.3391 | sofia.sousa-Dias@ontario.ca

મીડિયા રિલેશન્સ (Media Relations)

ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેનેડા (Infrastructure Canada)

613-960-9251

ટોલ ફ્રી: 18.77.250.7154

ઇમેલ: infc.media@canada.ca

અમને [Twitter](#), [Facebook](#) અને [Instagram](#) પર અનુસરો

વેબ: [ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેનેડા \(Infrastructure Canada\)](http://InfrastructureCanada.ca)

